

ત્વરિત જાહેરાત માટે

સીટીએ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રાઈડર્સ માટે BT સેફ ઓપ શરૂ કરી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 18, 2022) – સીટી ઓફ બ્રેમ્પટને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રાઈડર્સ માટે BT સેફ ઓપ શરૂ કરી છે.

iOS અને એન્ડ્રોઈડ માટે ઉપલબ્ધ BT સેફ ઓપ ટ્રાન્ઝિટમાં સુરક્ષાની જાણ મોબાઈલથી કરવાનો ઉકેલ છે. આ ઓપ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રાઈડર્સને સતમાણી, સુરક્ષાને લગતી ચિંતાઓ કે શંકાસ્પદ પ્રવૃત્તિઓ સીધી બ્રેમ્પટન ટ્રાન્ઝિટને જણાવવા માટે એક સગવડભરી, વપરાશકર્તા-અનુકૂળ અને વિવેકી પદ્ધતિ છે. કટોકટીના કિસ્સામાં, BT સેફ ઓપ રાઈડર્સને 9-1-1 પર પણ સીધી જાણ કરવા દે છે.

આ ઓપનો ઉપયોગ કરીને, ગ્રાહકો બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પર – પછી ભલે વાહન પર, ટર્મિનલ પર કે બસ સ્ટોપ પર જોવામાં આવતી ઘટનાઓ અને પરિસ્થિતિઓના વિગતવાર અહેવાલો પૂરા પાડીને ટ્રાન્ઝિટને વધારે સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થવા પોતાનો ભાગ ભજવી શકે છે. નોંધાયેલા મુદ્દાઓ ગોપનીય રહે છે અને અનામી રીતે જણાવી શકાય છે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોતાના રાઈડર્સ અને કર્મચારીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. BT સેફ ઓપ બ્રેમ્પટન ટ્રાન્ઝિટનો એવોર્ડ-વિજેતા [કંઈક જુઓ, કંઈક સાંભળો, કંઈક કલો \(સી સમર્થિંગ, લીયર સમર્થિંગ, સે સમર્થિંગ\)](#) જાહેર જગરૂકતા કાર્યક્રમનું વિસ્તરણ છે જે ટ્રાન્ઝિટ સિસ્ટમ સુરક્ષિતપણે જાળવવામાં અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સમુદાયની સુરક્ષાનું ધ્યાન રાખવામાં મદદરૂપ થાય છે. આ કાર્યક્રમ બ્રેમ્પટન ટ્રાન્ઝિટના કર્મચારીઓ અને રાઈડર્સને સુરક્ષામાં સચેત, માહિતગાર, તૈયાર અને સાથીઓ સાથે સામેલ રહેવા કટિબદ્ધ થવા પ્રોત્સાહિત કરે છે.

BT સેફ ઓપ વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો. વેબસાઈટ bramptontransit.com જુઓ અથવા [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને Twitter પર અનુસરીને ટ્રાન્ઝિટની હાલની અદ્યતન માહિતી મેળવો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

ક્વોટ્સ (અવતરણો)

“બ્રેમ્પટન એક આરોગ્યપ્રદ અને સુરક્ષિત શહેર છે, અને BT સેફ ઓપ સામુદાયિક સુરક્ષા માટે સહાયરૂપ છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોતાના રાઈડર્સ અને કર્મચારીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે, અને અમે વપરાશકર્તાઓને ઓપ મારફતે શંકાસ્પદ કે અસામાન્ય પ્રવૃત્તિ નોંધાવવા કહીએ છીએ. સાથે મળીને, આપણે આપણાં સમુદાયને સુરક્ષિત રાખી શકીએ છીએ.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“BT સેફ ઓપ iOS અને એન્ડ્રોઈડ પર ઉપયોગ કરવામાં સરળ મોબાઈલ ઓપ છે. જો તમને સુરક્ષાને લગતી ચિંતા જણાવવાની જરૂર પડે તો, બસ ઓપ ખોલો, અને મેસેજ સિક્યુરિટી સર્વિસીસને જાણ કરવા ‘રિપોર્ટ નાઉ’ પસંદ કરો, અથવા ‘પોલીસ, અગ્નિશમન કે તબીબી સહાયતાની જરૂર પડે ત્યારે કટોકટી નોંધાવવા ‘911 ઈમરજન્સી’ પસંદ કરો.”

- *પૉલ વિસેન્ટ (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; અધ્યક્ષ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ, સીટી ઓફ બ્રેમ્પટન*

“સીટી ઓફ બ્રેમ્પટન વધારેલી સુરક્ષા અને ખામીરહિત વાતચીત માટે તકો પૂરી પાડવા કટિબદ્ધ છે. BT સેફ ઓપ આ પહોંચાડવામાં બ્રેમ્પટન ટ્રાન્ઝિટ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.”

- *પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના મુખ્ય વહીવટી અધિકારી (ઈન્ટરીમ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર), સીટી ઓફ બ્રેમ્પટન*

“સુરક્ષા અમારી પ્રથમ અગ્રતા છે અને અમારું લક્ષ્ય એ ખાતરી કરાવવાનું છે કે આપણી સિસ્ટમ આપણાં રાઈડર્સ અને કર્મચારીઓ માટે સુરક્ષિત રહેવાનું ચાલુ રહે. આપણાં સૌની જવાબદારી એકબીજાને સુરક્ષિત રાખવાની છે અને અમે આપણાં સમુદાયને સુરક્ષા ચિંતાઓ નોંધાવવા પ્રોત્સાહિત કરીએ છીએ.”

- એલેક્સ મિલોજેવિક (Alex Milojevic), જનરલ મેનેજર, બ્રમ્પટન ટ્રાન્ઝિટ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca